



## Shree Swaminarayan Temple - Bhuj

Tirth Dham, Shree Swaminarayan Road, Opp. City Police Bhuj, Kutch – 370001 Gujarat, India

T: +91 (0)2832 250231 / 250331 | F: +91 (0)2832 250131 | E: info@bhujmandir.org

### Pastimes of Lord Swaminarayan

#### Departure from Mortal body

Antardhaan Leela / Tirodhaan Leela / Swadhaam Gaman Leela



Lord Swaminarayan's transcendental pastime of departing the mortal body is narrated in various Holy Scriptures of the Swaminarayan Sampraday. Reading and hearing about this event definitely brings tears to one's eyes and we can only imagine what must have been felt by those devotees and saints who were present with the Lord at that time.

We must remember that any pastime the Lord performs is always for the benefit of the devotee and always a one to remember. Shree Hari Antardhaan / Tirodhaan / Swadhaam gaman leela took place on the Vikram Samvat 1886, Jyest Sud 10.

Swami Avinashanand has composed a 2 Verse (Pad) Kirtan in which he sings of the event when Lord Swaminarayan held an assembly of devotees and saints informing them of His wish to depart to Akshardham and the series of events that unfolded thereafter to the Lords departure.

This article contains in-order the Gujarati and transliterated Gujarati version of this Kirtan along with the meanings of each lines.

Through this Kirtan we aim to understand the Lord's benediction upon His disciples during His time here on Earth in a human form and dilemma of the devotees during this difficult time.

## ઘોળ પદ - ૧

એક દિન સભા કરી શ્રીહરિ;  
બોલ્યા વાણી પોતે બલવીર, થઇ દીલગીર. શ્રીજી કહે સંતને.  
સર્વે સંત હરિજન સાંભળો;  
મારે કેવાની છે એક વાત, સાચી સાક્ષાત. શ્રીજી કહે ૧  
સર્વે કરવાનું કામ કરી રહ્યો;  
નથી બાકી રહ્યું લવ લેશ, સુણો ઉપદેશ. શ્રીજી કહે ૨  
ધ્યાન ધારણા જોગની જુગતિ;  
સૌને શીખવી મેં કરી પ્રીત, પરમ પુનિત. શ્રીજી કહે ૩  
મોટા મોટા મહારૂઢ ઘણા કર્યા;  
દીધાં બ્રાહ્મણને ઘણાં દાન, કરી સનમાન. શ્રીજી કહે ૪  
નરનારાયણાદિક દેવનાં;  
કીધાં મંદિર મોટાં અપાર, કરી અતિ પ્યાર. શ્રીજી કહે ૫  
દેશો દેશમાં ડંકો વગાડીયો;  
સ્વામિનારાયણ રટે નામ, જન આઠો જામ. શ્રીજી કહે ૬  
મતપંથી મોટા મોટા જીતીયા;  
લીધા છોડી તેના શિષ્ય જન, મુમુક્ષુ પાવન. શ્રીજી કહે ૭  
આપ્યા પરચા ઘણાને મેં આ સમે;  
નોતા દીઠા નોતા સુણ્યા કાન, ધરે મુનિ ધ્યાન. શ્રીજી કહે ૮  
સર્વે અધર્મ ભૂમિનો ટાળીયો;  
સ્થાપ્યો ધર્મ ધરાપર શુદ્ધ, વખાણે વિબુદ્ધ. શ્રીજી કહે ૯  
સૌને મોક્ષનો પંથ દેખાડીયો;  
આંખ્યું મીંચી સહુ જાય, સુખી અતિ થાય. શ્રીજી કહે ૧૦  
મારી મૂર્તિઓ મેં સ્થાપન કરી;  
તેમાં અખંડ રહું કરી વાસ, ટાળું જમ ત્રાસ. શ્રીજી કહે ૧૧  
વળી ધર્મનું કુળ તેડાવીયું;  
મોટા બંધવ રામપ્રતાપ, ઇચ્છારામ આપ. શ્રીજી કહે ૧૨  
બેઉ ભ્રાતના પુત્રને લઇને;

કીધા દત્તપુત્ર કરી પ્યાર, નિશ્ચય નિરધાર. શ્રીજી કહે ૧૩  
મોટા ભ્રાતના અવધપ્રસાદજી;  
નાના ભ્રાતના શ્રીરઘુવીર, મહારૂઢ ધીર. શ્રીજી કહે ૧૪  
તે બન્ને સુપુત્રોને લઇને;  
સ્થાપ્યા ગાદીએ કરી પ્યાર, અધિક ઉદાર. શ્રીજી કહે ૧૫  
દેશ સંત સહુ વહેંચી આપીયા;  
મારા તુલ્ય જાણી તતખેવ, કરો સહુ સેવ. શ્રીજી કહે ૧૬  
રહેજો વચન પ્રમાણે સહુ મળી;  
જેમ કે તેમ કરજો જરૂર, કરી માન દૂર. શ્રીજી કહે ૧૭  
શિક્ષાપત્રી જાણો મારી મૂરતિ;  
વાંચી વર્તજો સહુ નર નાર, લોપોમાં લગાર. શ્રીજી કહે ૧૮  
મોટા મોટા ગયા તજી દેહને;  
રામકૃષ્ણાદિક અવતાર, અનંત અપાર. શ્રીજી કહે ૧૯  
તેમ હું પણ આ તન ત્યાગીને;  
જાણો જાઇશ અક્ષરધામ, તજીને આ ઠામ. શ્રીજી કહે ૨૦  
લેશ કલેશ વાંસે કરશો નહીં;  
રહું સત્સંગમાંહી સદાય, કરીને ઉચ્છાવ. શ્રીજી કહે ૨૧  
કોઇ સ્નેહ કરી તન ત્યાગશે;  
તે તો પામશે કષ્ટ અપાર, વચન લોપનાર. શ્રીજી કહે ૨૨  
સહુ સંપ રાખી સત્સંગમાં;  
કરો કરાવો સહુ સત્સંગ, કરી ઉમંગ. શ્રીજી કહે ૨૩  
મુકી સત્સંગ દૂર જાવું નહિં;  
રહું પાસ કરી નિત્ય વાસ, જાણી મારા દાસ. શ્રીજી કહે ૨૪  
થોડા દિન પછી તમને વળી;  
તેડી રાખીશ હું મારી પાસ, થાશો ન ઉદાસ. શ્રીજી કહે ૨૫  
એમ અવિનાશાનંદજીનો નાથજી;  
બોલ્યા વાણી તે વજ્ર સમાન, ભુલ્યા સુણી ભાન. શ્રીજી કહે ૨૬

સુણી વાણી તે શ્રીધનશ્યામની;  
 સૌ સંત થઇને ઉદાસ, કેછે લઇ લઇ ધ્યાસ. શ્રીજી તમે સાંભળો.ટેક.  
 તમે જીવના જીવન જગપતિ;  
 શરણાગતના પાલક શ્યામ, સદા સુખધામ. શ્રીજી તમે ૧  
 પેલું અમૃત પાઇને પ્રીતથી;  
 હવે ઝેર ન પાશો જરૂર, દયા કરી દૂર. શ્રીજી તમે ૨  
 તમ વિના જે જગતમાં જીવવું;  
 તેથી મરવું ભલું મારા નાથ, કહીએ જોડી હાથ. શ્રીજી તમે ૩  
 વાલા હસવું તમારું છે હેરવું;  
 તે તો વિસરે નહીં પળ એક, કરીને વિવેક. શ્રીજી તમે ૪  
 જોઇ તમને દિવસ વા'લા જાય છે;  
 દિલે થાય છે સુખ અપાર, પ્રાણના આધાર. શ્રીજી તમે ૫  
 જેહ વાત કરી તમે વાલમાં;  
 તેને સુણી તપે ઘણું તન, મુંજાય છે મન. શ્રીજી તમે ૬  
 નિશ્ચે મેલીને જાશો જો નાથજી;  
 ઝુરી ઝુરી પડશે તન, વિના દરશન. શ્રીજી તમે ૭  
 જળ વિના નોખી પડી માછલી;  
 તેને દુઘમાં સુખ ન થાય, જરૂર જીવ જાય. શ્રીજી તમે ૮  
 વાલા પતિ વિના સતિ વિનતા;  
 તેને દુઃખના દિવસ જાય, શાંતિ નવ થાય. શ્રીજી તમે ૯  
 જેમ ચંદ્રવિયોગી ચક્રોરને;  
 જાણો યોગણી ચિંતા તે ચિત્ત, કહીએ કરી પ્રીત. શ્રીજી તમે ૧૦  
 જેમ કર વિના કરી દુઃખીયો;  
 વળી પાંખ વિના પંખી દીન, મનમેં મલિન. શ્રીજી તમે ૧૧  
 જેમ આંખ વિના જન આંધળો;  
 તેને સુખ નહિ લવ લેશ, કાયા પામે કલેશ. શ્રીજી તમે ૧૨  
 જેમ ચક્રવર્તી ભુપાલને;  
 એક પુત્ર હોય મરી જાય, તેને કેવું થાય. શ્રીજી તમે ૧૩

જેમ સરિતા નિર વિના વળી;  
 જન દેખી પામે મન ત્રાસ, હોય અતિ પ્યાસ. શ્રીજી તમે ૧૪  
 જેમ વેલી દઝાણી દાહમાં;  
 પાછી લીલી કેદી નવ થાય, જોઇ નવ જાય. શ્રીજી તમે ૧૫  
 જેમ ચંદ્ર વિના જાણો જામની;  
 વળી દીપક વિનાનું ઘર, દેખી લાગે ડર. શ્રીજી તમે ૧૬  
 જેમ રવિ વિના દિન જાણીયે;  
 તેમ તમ વિના અમે નાથ, દુઃખી સહુ સાથ. શ્રીજી તમે ૧૭  
 તમ વિનાનું સુખ ત્રિલોકમાં;  
 થાય ઝેર રે શ્યામ સુજાણ, પ્યારા જન પ્રાણ. શ્રીજી તમે ૧૮  
 તમે મુકીને જાઓ જો ધામમાં;  
 તજીએ અમે તરત પ્રાણ, ધરમકુલ ભાણ. શ્રીજી તમે ૧૯  
 પણ આજ્ઞા અહીં ઉલ્લંઘતા;  
 બહુ લાગે છે મનમાં બીક, કહીએ ઠીકા ઠીક. શ્રીજી તમે ૨૦  
 આવું ના ઘટે તમને આ સમે;  
 શરણાગત મૂકીને શ્યામ, જાવું નિજ ધામ. શ્રીજી તમે ૨૧  
 વાલા વિરહ અમે કેમ વેઠીએ;  
 ક્યારે લેશો આવીને સંભાળ, દીનના દયાળ. શ્રીજી તમે ૨૨  
 તમે તરણ તાર ત્રિભુવન તણા;  
 સર્વે સુખના સાગર શ્યામ, અતિ અભિરામ. શ્રીજી તમે ૨૩  
 તમે કરતા અકરતા છો નાથજી;  
 નથી તમારા ઉપર કોઇ, કહીએ ચિત્ત પ્રોઇ. શ્રીજી તમે ૨૪  
 જેમ સુખ થાય સહુ સાથને;  
 તમે કરજો વેલો ઉપાય, કહીએ લાગી પાય. શ્રીજી તમે ૨૫  
 ઘણું શું કહીએ તમને નાથજી;  
 તમે અંતરજામી અનુપ, સદા સુખરૂપ. શ્રીજી તમે ૨૬  
 સુણી અરજી તે નિર્મોહી સંતની;  
 પછી અવિનાશાનંદનો નાથ, મુકી સંત સાથ. શ્રીજી ગયા ધામમાં. ૨૭

## **Rāga dhola**

### **Pada - 1**

Eka dina sabhā karī śrīhari;  
bolyā vāñī pote balavīra, thai dīlagīra. śrījī kahe saītane.  
sarve saīta harijana sām̄bhaḷo;  
māre kevañī che eka vāta, sācī sakṣāta. śrījī kahe 1  
sarve karavañum̄ kāma karī rahyo;  
nathī bakī rahyum̄ lava leṣa, suṇo upadeṣa. śrījī kahe 2  
dhyāna dhāraṇā joganī jugati;  
soune śikhavī meṁ karī pīta, parama punita. śrījī kahe 3  
moṭā moṭā mahārūdra ghaṇā karya;  
dīdhām̄ brāhmaṇane ghaṇām̄ daṇa, karī sanamaṇa. śrījī kahe 4  
naraṇārāyaṇādika devaṇā;  
kīdhām̄ maṇdira moṭām̄ apāra, karī ati pyāra. śrījī kahe 5  
deṣo deṣamaṁ ḍaṅko vagaḍīyo;  
svāmīnārāyaṇa raṭe nāma, jana āṭho jāma. śrījī kahe 6  
mata pañthī moṭā moṭā jītiyā;  
līdhā choḍī tenā śiṣya jana, mumukṣu pāvana. śrījī kahe 7  
āpyā paracā ghaṇāne meṁ ā same;  
notā dīthā notā suṇyā kāna, dhare muni dhyāna. śrījī kahe 8  
sarve adharma bhūmino ṭāḷīyo;  
sthāpyo dharma dharaṇa sūddha, vakhāṇe vibuddha. śrījī kahe 9  
soune mokṣano pañtha dekhaḍīyo;  
ānkhyum̄ mīncī sahu jāya, sukhī ati thāya. śrījī kahe 10  
mārī mūr̄tio meṁ sthāpana karī;  
temām̄ akhaṇḍa rahum̄ karī vāsa, ṭāḷum̄ jama trāsa. śrījī kahe 11  
vaḷī dharmanum̄ kuḷa teḍāvīyū;  
moṭā baṇdhava rāmaprataṇa, icchārāma āpa. śrījī kahe 12  
beu bhraṭanaṁ putrane laine;  
kīdhā dattaputra karī pyāra, niścaya niradhāra. śrījī kahe 13  
moṭā bhraṭanaṁ avadhaprasāḍajī;  
naṇā bhraṭanaṁ śrīraghuvīra, mahādraḍha dhīra. śrījī kahe 14  
te banne suputrane laine;  
sthāpyā gāḍīe karī pyāra, adhika udāra. śrījī kahe 15  
deṣa saīta sahu vaheñcī āpiyā;  
mārā tulya jāñī tatakheva, karo sahu seva. śrījī kahe 16  
rahejo vacana pramaṇe sahu maḷī;  
jema ke tema karajo jarūra, karī māna dūra. śrījī kahe 17  
śikṣāpatrī jāṇo mārī mūr̄ati;  
vāñcī vartajo sahu nara nāra, lopomām̄ lagaṇa. śrījī kahe 18  
moṭā moṭā gayā tajī dehane;  
rāmākṣṇādika avatāra, anaīta apāra. śrījī kahe 19  
tema hum̄ paṇa ā tana tyāgīne;

jāṇo jāśa akṣaradhāma, tajīne ā ṭhāma. śrījī kahe 20  
leśa kaleśa vāmse karaśo nahī;  
rahuṁ satsaṅgamāṁhī sadāya, karīne ucchāva. śrījī kahe 21  
koi sneha karī tana tyāgaśe;  
te to pāmaśe kaṣṭa apāra, vacana lopaṅāra. śrījī kahe 22  
sahu saṁpa rakhī satsaṅgamāṁ;  
karo karaṅvo sahu satsaṅga, karī umaṅga. śrījī kahe 23  
mukī satsaṅga duṛa jāvuṁ nahi;  
rahuṁ paśa karī nitya vāśa, jāṇī māṛā dāśa. śrījī kahe 24  
thoḍā dina pachī tamane vaḷī;  
teḍī rakhīśa huṁ māṛī paśa, thaśo na udāśa. śrījī kahe 25  
ema avinaśāṅandajīno nāthajī;  
bolyā vaṅī te vajra samaṅa, bhulyā suṅī bhāṅa. śrījī kahe 26

#### Pada - 2

suṅī vaṅī te śrīghanaśyaṁāni;  
sou saṅta thaine udāśa, keche lai lai śvāśa. śrījī tame saṁbhālo.ṭeka.  
tame jīvanā jīvana jagapati;  
śaraṅāgatanaṁ paḷaka śyaṁa, sadaṁ sukhadhāma. śrījī tame 1  
peluṁ amṛta paīne prītathī;  
have jhera na paśo jaruṛa, dayā karī duṛa. śrījī tame 2  
tama vinā je jagatamaṁ jīvavuṁ;  
tethī maravuṁ bhaluṁ māṛā nātha, kahīe joḍī hātha. śrījī tame 3  
vaḷā hasavuṁ tamāruṁ che heravuṁ;  
te to visare nahīṁ paḷa eka, karīne viveka. śrījī tame 4  
joi tamane divasa vaḷā jāya che;  
dile thāya che sukha apāra, praṅānā ādhāra. śrījī tame 5  
jeha vāta karī tame vaḷamāṁ;  
tene suṅī tape ghaṅuṁ tana, muṅjāya che mana. śrījī tame 6  
niśce mellīne jāśo jo nāthajī;  
jhurī jhurī paḍaśe tana, vinā daraśana. śrījī tame 7  
jaḷa vinā nokhī paḍī māchalī;  
tene dudhamāṁ sukha na thāya, jaruṛa jīva jāya. śrījī tame 8  
vaḷā pati vinā sati vinatā;  
tene duḥkhanaṁ divasa jāya, śānti nava thāya. śrījī tame 9  
jema caṅdravīyogī cakorane;  
jāṇo cogaṅī cīntā te citta, kahīe karī prīta. śrījī tame 10  
jema kara vinā karī duḥkhīyo;  
vaḷī paṅkha vinā paṅkhī dīna, manameṁ malina. śrījī tame 11  
jema āṅkha vinā jana āṅdhaḷo;  
tene sukha nahi lava leśa, kāyā paīme kaleśa. śrījī tame 12

jema cakravartī bhupaṇane;  
 eka putra hoyā marī jāya, tene kevuṁ thāya. śrījī tame 13  
 jema saritā nira vinā vaḷī;  
 jana dekhī pāme mana trāsa, hoyā ati pyāsa. śrījī tame 14  
 jema velī dajhāñī dāhamāñ;  
 pāchī līlī kedī nava thāya, joi nava jāya. śrījī tame 15  
 jema caṇdra vinā jāñho jāmanī;  
 vaḷī dīpaka vinañuṁ ghara, dekhī laḡe ḍara. śrījī tame 16  
 jema ravi vinā dina jāñīye;  
 tema tama vinā ame nātha, duḡkhī sahu sātha. śrījī tame 17  
 tama vinañuṁ sukha trilokamāñ;  
 thāya jhera re śyāma sujāña, pyārā jana prāña. śrījī tame 18  
 tame mukīne jāo jo dhāmamāñ;  
 tajīe ame tarata prāña, dharamakula bhāña. śrījī tame 19  
 paña ājñā ahīñ ullānghata;  
 bahu laḡe che manamāñ bīka, kahīe ṭhīka ṭhīka. śrījī tame 20  
 āvuṁ nā ghaṭe tamane ā same;  
 śaraṇāgata mukīne śyāma, jāvuṁ nija dhāma. śrījī tame 21  
 vaḷā viraha ame kema veṭhīe;  
 kyāre lešo āvīne sambhāḷa, dīnanā dayaḷa. śrījī tame 22  
 tame taraña tāra tribhuvana taṇā;  
 sarve sukhanā sāgara śyāma, ati abhiraṁma. śrījī tame 23  
 tame karatā akaratā cho nāthajī;  
 nathī tamārā upara koi, kahīe citta proi. śrījī tame 24  
 jema sukha thāya sahu sāthane;  
 tame karajo velo upāya, kahīe laḡī pāya. śrījī tame 25  
 ghañuṁ śuṁ kahīe tamane nāthajī;  
 tame aṅtarajāmī anupa, sadā sukharuḷpa. śrījī tame 26  
 suñī arajī te nirmohī sañtanī;  
 pāchī avinaśāñaidano nātha, mukī sañta sātha. śrījī gayā dhāmamāñ. 27



## Verse (Pad 1)

### Shreeji spoke to the Saints...

One day Shree Hari called upon a congregation of saints and devotees and spoke regretfully, Shreeji spoke to the Saints - All saints and devotees, kindly listen as I wish to tell you the truth<sup>1</sup> I have performed all there was according to My plans and now listen to My counselling words<sup>2</sup> With affection, I have taught all disciples the ways of utmost pure spiritual practices<sup>3</sup> I have performed several grand Maharuda spiritual sacrifices (Yagna) and given many alms to the Bhramins with respect<sup>4</sup> Out of love, built grand Temples of NarNarayan Dev and other forms (of Himself)<sup>5</sup> Spread the fame and glory of devotion across cities and countries, everybody chants the name 'Swaminarayan' 24x7<sup>6</sup> Defeated various big irreligious practitioners and made rescued their spiritually aspirant disciples (granted them true knowledge)<sup>7</sup> I have shown many, My prowess this time, ones which have neither be seen nor heard of upon which the sages meditate<sup>8</sup> Uprooted all irreligiousness and established righteousness which the wise praise<sup>9</sup> Shown all the path to salvation which they attain after leaving the mortal body and gain ultimate transcendental bliss<sup>10</sup> Established My forms in Temples and residing within them, I eradicate the fears of the messengers of death (Yamdoots)<sup>11</sup> Called forth the clan of Dharma (Dharmakul), brothers Rampratap and Ichharam<sup>12</sup> With affection, certainty and determination I adopted their sons<sup>13</sup> Of elder brother, Ayodhyaprasad and of younger, Shree Raghuveer; the great and determined.<sup>14</sup> I enthroned them unto their dioceses with affection<sup>15</sup> Divided the cities and saints amongst these dioceses, know them as My successors in authority and serve them well<sup>16</sup> Surely obey their commandments leaving aside all ignorance and ego<sup>17</sup> Know the Shikshapatri as My form, read it and abide by the commandments within without fail<sup>18</sup> Many big personalities have left their mortal body, Ram Krushna and various other infinite and immeasurable incarnations<sup>19</sup> Similarly I too will leave this mortal body and depart for Akshardham<sup>20</sup> Do not be disheartened at all after I am gone as I am ever-present in Satasang with joy<sup>21</sup> If out of attachment anyone passes away after me (i.e. leaves their body forcefully), they will face great difficulties due to their disobedience<sup>22</sup> All shall maintain harmony in Satang and with enthusiasm engage others in it<sup>23</sup> One shall not leave Satsang for I will always reside with My humble disciples<sup>24</sup> After some time I will take you in My company therefore do not be disheartened<sup>25</sup> Thus spoke the Master of Avinashanand, words that felt like a thunderbolt, bewildering the whole congregation.<sup>26</sup>

### Summary of Verse 1:

In this verse the Lord openly elaborates on His endeavours and their successful achievements for the betterment for the whole society. Through this pastime Lord wants to teach the society that whosoever takes birth upon Earth is destined to depart one day. In this case He is an inspirational figure and the Lord of all providing the necessary strength needed through spiritual counsel (Updesh). In only forty nine years of His age on Earth, He established righteousness and gave the society spiritual teachings for their uplift towards the road to Godhead i.e. Akshardham.

## Verse (Pad 2)

### The congregation spoke out...

After listening to the words of Shree Ghanshyam, all saints were disheartened and with deep breaths spoke to the Lord, Listen Oh! Shreeji – You are the life of the soul, the Master of the Universe, the nurturer of those who are at Your refuge, always the abode of transcendental bliss<sup>1</sup> First you affectionately nurtured us with nectar, now please do not be merciless and give us poison<sup>2</sup> It is better to die than to live without Your company in this world My Master, we plead with hands-folded<sup>3</sup> My Lord Your smile is divine which we are unable to forget even for a second<sup>4</sup> In Your company we spend our days experiencing immeasurable bliss, You are our means of existence<sup>5</sup> Hearing Your words our body is raging with heat and our minds are bewildered<sup>6</sup> For if you definitely leave us, we will surely pass away in agony of Your separation<sup>7</sup> If a fish is separated from water, it cannot experience bliss in milk as it will definitely pass away<sup>8</sup> A chaste wife without her husband is widowed, her days pass away in sorrow without any peace<sup>9</sup> Out of affection, the Chakor bird experiences great anxiety from separation of the sight of the moon<sup>10</sup> An elephant is sorrowful without its trunk and a wingless bird afflicted<sup>11</sup> Without eyesight one is blind hence the cause of bodily misery<sup>12</sup> An all ruler King loses his only son, how would he feel<sup>13</sup> Thirsty people come along a waterless river<sup>14</sup> A climbing plant faces catches fire and is burnt, it never turns green again and its unworthy of sight<sup>15</sup> One would be petrified in darkness of the night without the moon and in a house devoid of the light from earthen lamps<sup>16</sup> Similarly daytime without sunlight, such will be our sorrowful state without You<sup>17</sup> Without You the bliss of three worlds is like poison Oh wise Shyam; source of life for devotees<sup>18</sup> If You depart for Akshardham leaving us behind, we will surely pass away instantly of jewel of Dharmakul<sup>19</sup> But we are very scared of disobedience to Your commandment (of not passing away forcefully)<sup>20</sup> You should not be leaving Your humble devotees at this time and depart for Akshardham, Oh wise Shyam<sup>21</sup> How will we bear this separation and when will you grace us with Your presence Oh merciful One<sup>22</sup> You are excellent uplifter of the three worlds, Shyam (dark complexioned One) the very pleasant ocean of transcendental bliss<sup>23</sup> You are the doer and non-doer Oh Master, there is no one above You, we say that firm consciousness<sup>24</sup> To bring upon bliss to Your devotees we humbly bow to Your feet for a remedy at Your earliest<sup>25</sup> How much shall we request to You Oh Master, You are the very form of happiness, the incomparable all-knower<sup>26</sup> The Lord listened to the request of the saints who were free of illusion (Nirmohi), then Avinashanand's Master; Shreeji amidst the saints departed for Akshardham<sup>27</sup>

### Summary of Verse 2:

In this verse the devotees and saints bewildered by the Lord's words in verse one humbly plead the Lord not to go. They have used various real life scenarios of miseries faced by both humans and animals and put forward to the Lord a scenario of the state they would attain upon separation from Him. These saints and devotees accompanied the Lord everywhere He went, had sight of Him every day during His various daily routines. They were fully engrossed in His form. The plea to the Lord for staying is only just, however the Lord is free to do as He pleases for the benefit of the society. As mentioned before, He is always present in divine form within Satsang and continues to grant benediction to His humble devotees. In the 6<sup>th</sup> Kalash (Canto) and 27<sup>th</sup> Vishram (Chapter) of Harileelamrut, respected Acharya Shree Viharilalji Maharaj elaborates on where 'Shree Swaminarayan' reside. It is a text surely worth reading and remembering.